

A2Z INFRA ENGINEERING LTD.
(CIN: L74999HR2002PLC034805)
Registered Office: O-116, 1st Floor, DLF Shopping Mall, Arjun Marg, DLF City, Phase 1, Gurugram-122002, (Haryana)
Corporate Office: Plot No. B-38, Sector 32, Institutional Area, Gurugram-122001 (Haryana)
E-mail: investor.relations@a2zemail.com, Website: www.a2zgroup.co.in
Tel.: 0124-4517600, Fax: 0124-4380014

NOTICE
Pursuant to Regulation 29 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, NOTICE is hereby given that a Meeting of Board of Directors of the Company will be held on **Thursday, the 30th day of July, 2020** at Gurugram, inter-alia to Consider, approve and take on record the Audited Standalone and Consolidated Financial Results for the Quarter (Q4) and year ended 31st March, 2020 and other related matter.

This Notice shall also be available on the website of the company at <http://www.a2zgroup.co.in/investor-relations/corporate-announcements.html> and the website of the stock exchange i.e. www.nseindia.com & www.bseindia.com.

For A2Z INFRA ENGINEERING LTD.
Sd/-
Atul Kumar Agarwal
President & Company Secretary

Place: Gurugram
Date : 23rd July, 2020

BIRLA PRECISION TECHNOLOGIES LIMITED
23, Birla Mansion No. 2, 1st Floor, D. D. Sathe Marg, Prarthana Samaj, Mumbai 400 004
Tel.: +91 022-23825060 E-mail : info@birlaprecision.com
Website : www.birlaprecision.in
An ISO 9001:2000 & ISO 14001:2004 Company
CIN: L29220MH1986PLC041214

NOTICE
Pursuant to Regulation 29 and Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, **NOTICE** is hereby given that a Meeting of the Board of Directors of the Company, will be held on **Thursday, 30th July, 2020** to inter alia consider & approve the Audited Financial Results for the Quarter/Year ended 31st March, 2020.

The said intimation will be available on Website of the Company at www.birlaprecision.in and the website of Stock Exchange at www.bseindia.com.

For Birla Precision Technologies Limited
Sd/-
Shajjal Jain
Company Secretary

Date: 22.07.2020
Place: Mumbai

बैंक ऑफ बड़ौदा बैंक ऑफ बड़ौदा Bank of Baroda
Bank of Baroda, Vadnagar Branch – Bazar, Vadnagar-384355. Dist. Mehsana, Gujarat
Phone : 02761-222057 E-mail : vadnag@bankofbaroda.co.in

Demand Notice [Rule 13(2)]

Demand Notice under Section 13(2), read with section 13(13), Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. A/c – Mr. Kiran Dahyabhai Desai (Borrower) and Mr. Dahyabhai Sankabhai Rabari (Co-Borrower), credit facility with Our Vadnagar Branch of Vadnagar.

Details of the Borrower
(1) Kiran Dahyabhai Desai (Borrower), (2) Mr. Dahyabhai Sankabhai Rabari (Co-Borrower) Both Resi at: S2, Saundarya Apartment, Part2, Near Arjun Tower, Ghatlodia, Ahmedabad, Gujarat-380061.

The undersigned has issued demand notice dated 17.02.2020 to the above Borrower under Section 13(2) of Securitisation and Re-construction of financial Assets and Enforcement of Security Interest Act 2002 on your last known addresses, however the same have been returned unserved/undelivered by postal authorities with various reasons for non-delivering.

A notice is hereby given that you (above borrower) have defaulted in the repayment of principle as well as interest of credit facilities availed by you from the Bank of Baroda Vadnagar Branch, Vadnagar and your account is classified into Non Performing Assets (NPA) on 31.01.2020 in accordance with the directions / guideline issued by the Reserve Bank of India. The details of the credit limits and the Outstanding against each credit facility are as under :

Nature & Type of Facility	Limit (Rs.) In lakhs	Rate of Interest	O/s as on 30-01-2020 (inclusive of interest up to 30.01.2020)	Security Agreement with brief description of securities
Baroda Mortgage Loan against Property	9.00	10.60% PA with monthly Rest	8,00,234.42	Security: The Details of mortgaged security as under: All piece & Parcel of the property bearing City Survey No. 163, located at Tikka No. 9/3, MC No. 3/539, Zeriya Vas, Amarthole Gate, admeasuring 71.07.10 Sq. Mtr., Vadnagar, Ta: Vadnagar, Distt. Mehsana, Gujarat Boundaries of Property: On East: Border of property of C S No. 164, On West : Border of property of C S No. 162, On North: Border of property of C S No. 161, On South: Way of Maholla after the door and Otia. The above property is mortgaged with Bank of Baroda, Vadnagar Branch through "The Instrument relating to deposit of Title Deeds" which was duly registered with Sub Registrar office, Vadnagar vide Registration No.534 dated 30.06.2017.

You are also liable to pay further contractual rate (compounding) from 31.01.2020 with monthly rest plus 2% PA (simple) penal interest till realization.

You are advised to make the payment of **Rs. 8,00,234.42 (Rupees Eight Lac Two Hundred Thirty Four and Paise Forty Two only)** plus further contractual rate of interest and legal expenses till full and final payment, within 60 days from the date of publication of this notice failing which the Bank as a secured creditor shall be entitled to enforce its security interest without intervention of the Court or Tribunal by taking recourse to one or more of the measures under Chapter - III of the Act including (but not limited to) taking over of the possession and sale or Management of the Assets charged to the Bank for realizing the Bank's dues at your own risk as to the costs and consequences thereof.

We further invite your attention to sub section (8) of section 13 of the said Act in terms of which you may redeem the secured assets, if the amount of dues together with all costs, charges and expenses incurred by the Bank is tendered by you, at any time before the date of publication of notice for public auction/ inviting quotations/ tender/ private treaty. Please note that after publication of the notice as above, your right to redeem the secured assets will not be available.

Please note that after receipt of this notice in terms of section 13 (13) of the Act you shall not transfer by way of sale, lease or otherwise (other than in the ordinary course of your business) any of the assets hypothecated/ mortgaged to the Bank without prior consent of the Bank. We may add that non-compliance with this provision is punishable under section 29 of the Act.

Please further note that this statutory notice is issued without prejudice to all the other rights and remedies available to the Bank, for recovering its dues from you. This notice to the concerned parties is an alternate form of notice as service of substituted notice under Rule 3(1) SI Rules 2002

Date : 17.02.2020,
Place: Vadnagar

The Authorised officer, Chief Manger, Bank of Baroda, Vadnagar Branch, Vadnagar

POST BOX No. 10077
TEL. NOS.: +91 22 22197101
FAX: 0091-22- 2207 1612 / 6772
Email: write@bseindia.com
Website: www.bseindia.com
CIN: L9999MH1863PLC00002

THE BOMBAY BURMAH TRADING CORPORATION, LIMITED
REGD. OFFICE : 9, WALLACE STREET, FORT, MUMBAI 400 001, INDIA.

PUBLIC NOTICE
Notice is hereby given pursuant to Regulations 29 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that a Meeting of the Board of Directors of the Corporation will be held on Wednesday, 29th July, 2020 to inter-alia, consider and approve the Unaudited Financial Results (Standalone and Consolidated) of the Corporation for the first quarter ended 30th June, 2020. This information is also available on the website of the Corporation www.btcl.com and on the website of the Stock Exchanges i.e. www.bseindia.com and www.nseindia.com

For The Bombay Burmah Trading Corporation, Limited,
Sd/-
Sanjay Kumar Chowdhary
Company Secretary

Mumbai; 22.07.2020

यूनियन बैंक Union Bank of India
Registered Office: Ashram Road Branch, C.U. Shah Chambers, Nr. Gujarat Vidyalay, Ashram Post Box No. 17, Ahmedabad. Ph. 079 - 27540 0617, 2754 2613

POSSESSION NOTICE [Rule - 8(1)]

Whereas, The undersigned being the authorised officer of the **Union Bank of India, Ashram Road Branch, Ahmedabad** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated **31st July, 2017** calling upon the borrower **M/s. Suzuki Suitings Pvt. Ltd.** to repay the amount mentioned in the notice being **Rs.10,32,51,186.57** (in words Ten Crores Thirty Two Lacs Fifty One Thousand One Hundred Eighty Six and Fifty Seven Paise Only) within 60 days from the date of receipt of the said notice.

The borrower as well as guarantors having failed to repay the total amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken/received possession of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the said rules on this **21st day of July of the year 2020**.

Borrower/Guarantor's attention is invited to provisions of sub-section (8) of section 13 of the said Act, in respect of time available to redeem the secured assets.

The **Borrower/Guarantors** in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **Union Bank of India, Ashram Road Branch, Ahmedabad for the amount of Rs.10,32,51,186.57** (in words Ten Crores Thirty Two Lacs Fifty One Thousand One Hundred Eighty Six and Fifty Seven Paise Only) **as on 29-07-2017 and further interest and expense thereon.**

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY
ALL THAT PIECE & PARCEL of lease hold property being plot no. 2204, admeasuring about 2016 Sq. Mtr with construction thereon, in the known as "CHHATRAL INDUSTRIAL ESTATE" of GIDC for the terms of 99 years computed from the 06.04.1990, situated on land bearing survey no. 135/p situated lying and being at Mouje Village Chhatral, Taluka: Kalol, Registration District Gandhinagar Sub-District Kalol property held in the name of M/s. Suzuki Suitings Pvt. Ltd. bounded as follows: **Bounded:** On the North by: Plot No. 2207. On the South by: 14 Mtrs. Wide Road. On the East by: Plot No. 2205. On the West by: Plot No. 2203.

Date: 21/07/2020
Place: Chhatral

Authorised Officer
Union Bank of India

BLUE CHIP INDIA LIMITED
Regd. Office : 10 Princep Street, 2nd Floor, Kolkata - 700072
E : info@bluechipind.net, W : www.bluechipind.net
Phone : 91-33-4002 2880, Fax : 91-33-2237 9053
CIN : L65991WB1993PLC060597

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE 4TH QUARTER & YEAR ENDED 31ST MARCH, 2020 (Rs. in Lacs)

Sl. No.	Particulars	Quarter ended			Year Ended	
		31.03.2020 (Audited)	31.12.2019 (Unaudited)	31.03.2019 (Audited)	31.03.2020 (Audited)	31.03.2019 (Audited)
1	Total Income from Operations	0.05	-	0.17	0.08	3.24
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	(5.86)	(4.32)	(15.10)	(124.97)	(36.92)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	(5.86)	(4.32)	(16.38)	(124.97)	(38.20)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	(108.86)	(32.86)	(43.04)	(300.59)	(64.86)
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	1106.09	1106.09	1106.09	1106.09	1106.09
6	Equity Share Capital	-	-	-	(1125.27)	(824.68)
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	-
8	Earnings Per Share (of Rs. 2/- each) (for continuing and discontinued operations)	(0.20)	(0.06)	(0.08)	(0.54)	(0.12)
	1. Basic:	(0.20)	(0.06)	(0.08)	(0.54)	(0.12)
	2. Diluted:	(0.20)	(0.06)	(0.08)	(0.54)	(0.12)

Note:
a) The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the Stock Exchanges website i.e. www.nseindia.com, www.bseindia.com and www.cse-india.com and on the Company's website: www.bluechipind.net
b) The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote.
c) # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / IAS Rules, whichever is applicable.

By order of the Board
For BLUE CHIP INDIA LIMITED
Sd/-
Arihant Jain
Managing Director
DIN: 00174557

Place : Kolkata
Date : 22nd July, 2020

IEX INDIAN ENERGY EXCHANGE
CIN: L74999DL2007PLC277039
Registered & Corporate Office: Unit No. 3, 4, 5 & 6, Fourth Floor, TDI Centre Plot No. 7, District Centre, Jasola, New Delhi 110 025
Tel: +91 (11) 4300 4000; Fax: +91 (11) 4300 4015
E-mail: compliance@iexindia.com; Website: www.iexindia.com

NOTICE

Pursuant to the Regulation 29 and Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Wednesday, July 29, 2020, inter-alia, to consider, approve and take on record, the Standalone & Consolidated Un-audited Financial Results of the Company for the quarter ended June 30, 2020.

Further, the Trading Window for dealing in Shares of the Company is already closed and shall open after 48 hours of the declaration of the above referred Financial Results.

This information is also available on the website of the Company i.e. www.iexindia.com and the website of the BSE Limited and National Stock Exchange of India Ltd (i.e. www.bseindia.com and www.nseindia.com), the Stock Exchanges where the Company's shares are listed.

For Indian Energy Exchange Limited
Sd/-
Vineet Harlalka
CFO, Company Secretary & Compliance Officer
Membership No. ACS-16264

Place: New Delhi
Date: July 23, 2020

FORM G INVITATION FOR EXPRESSION OF INTEREST
(Under Regulation 36A(1) of the Insolvency and Bankruptcy (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016)

RELEVANT PARTICULARS	
1. Name of the corporate debtor	M/s Sunlight Extrusion Private Limited
2. Date of incorporation of corporate debtor	10 th January, 2002
3. Authority under which corporate debtor is incorporated / registered	ROC – Ahmedabad Under the Companies Act, 1956.
4. Corporate identity number / limited liability identification number of corporate debtor	U27201GJ2002PTC040352
5. Address of the registered office and principal office (if any) of corporate debtor	501 (I) 502 (I) 513 514, GIDC Estate-Waghodia, Baroda, Gujarat- 391 760, India
6. Insolvency commencement date of the corporate debtor	25 th February, 2020 (NCLT order received on dated 17th March, 2020)
7. Date of invitation of expression of interest	24-07-2020
8. Eligibility for resolution applicants under section 25(2)(h) of the Code is available at:	Details can be obtained by sending E-mail at: cirp.sepl@ddip.in
9. Norms of ineligibility applicable under section 29A are available at:	Available on this website as under: https://ibbi.gov.in/webfront/legal_framework.php
10. Last date for receipt of expression of interest	10-08-2020
11. Date of issue of provisional list of prospective resolution applicants	20-08-2020
12. Last date for submission of objections to provisional list	25-08-2020
13. Date of issue of final list of prospective resolution applicants	04-09-2020
14. Date of issue of information memorandum, evaluation matrix and request for resolution plans to prospective resolution applicants	25-08-2020
15. Manner of obtaining request for resolution plan, evaluation matrix, information memorandum and further information	Information memorandum to be obtained from Resolution Professional after submission of duly executed Non-Disclosure Agreement.
16. Last date for submission of resolution plans	24-09-2020
17. Manner of submitting resolution plans to resolution professional	Speed Post/ Registered Post/ Hand Delivery/Courier
18. Estimated date for submission of resolution plan to the Adjudicating Authority for approval	24-10-2020
19. Name and registration number of the resolution professional	Mr. Abhishek Nagori IBBI/IPA-001/IP-P00020/2016-2017/10044
20. Name, Address and e-mail of the resolution professional, as registered with the Board	Mr. Abhishek Nagori 330/348, Third Floor, Tower-A, Atlantis K-10, Opp. Vadodara Central, Sarabhai Main Road, Vadodara-390023, Gujarat- India. Email: jlnusb@gmail.com
21. Address and email to be used for correspondence with the resolution professional	330/348, Third Floor, Tower-A, Atlantis K-10, Opp. Vadodara Central, Sarabhai Main Road, Vadodara-390023, Gujarat- India. Email: cirp.sepl@ddip.in
22. Further Details are available at or with	Mr. Abhishek Nagori Resolution Professional for M/s Sunlight Extrusion Private Limited 330/348, Third Floor, Tower-A, Atlantis K-10, Opp. Vadodara Central, Sarabhai Main Road, Vadodara-390023, Gujarat- India. Email: cirp.sepl@ddip.in
23. Date of publication of Form G	24-07-2020

Sd/-
Mr. Abhishek Nagori
Resolution Professional (RP) for M/s Sunlight Extrusion Private Limited
Registration No. IBBI/IPA-001/IP-P00020/2016-2017/10044

Place: Vadodara
Date: 24th July, 2020

APAR INDUSTRIES LIMITED
(CIN : L91110GJ1989PLC012802)
Registered Office : 301, Panorama Complex, R. C. Dutt Road, Vadodara - 390 007 (Gujarat), India.
Phone : (0265) 2339906 ; Fax : (0265) 2330309 Website : www.apar.com, E-mail : com_sec@apar.com

NOTICE OF THE 31ST ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

Notice is hereby given that :

- The Thirty-First (31st) Annual General Meeting (AGM) of the Shareholders of Apar Industries Limited ('the Company') will be held on **Monday, August 17, 2020 at 02:30 P.M. (IST)** through Video Conferencing (VC) / Other Audio-Visual Means (OAVM) in compliance with General Circular No. 14/2020 dated April 08, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020 and General Circular No. 20/2020 dated May 05, 2020 and other applicable circulars, if any, issued by the Ministry of Corporate Affairs (MCA) and SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 Circular issued by the Securities and Exchange Board of India (SEBI) (herein after collectively referred to as 'Circulars') vide which, companies are allowed to hold AGMs through VC / OAVM, without the physical presence of members at a common venue. Hence, the 31st AGM of the Company is being held through VC / OAVM to transact the business as set forth in the Notice of the 31st AGM dated June 25, 2020. Members participating through the VC / OAVM facility shall be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act, 2013.
- In compliance with the Circulars, electronic copies of the Notice of the 31st AGM and Annual Report 2019-20 have been sent to all the members whose email IDs are registered with the Company / Depository Participant(s). These documents are also available on the website of the Company at www.apar.com, stock exchange websites i.e. BSE Limited (BSE) and National Stock Exchange of India Limited (NSE) at www.bseindia.com and www.nseindia.com respectively and also on the CDSL's website at <https://www.evotingindia.com>. The dispatch of Notice of the AGM through emails has been completed on 22nd July, 2020.
- In terms of Section 108 of the Companies Act, 2013 read with amended Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time, the following information is available to the Shareholders of the Company :
Members holding equity shares either in physical form or dematerialization form, as on the cut-off-date (Record date) Monday, 10th August, 2020, may cast their vote electronically on the business as set forth in the Notice of the 31st AGM dtd. June 25, 2020 through the electronic voting system of Central Depository Services (India) Limited (CDSL) (an Agency appointed for the purpose of providing remote e-voting facility and e-voting system during the AGM to the Shareholders of the Company).
All the members are hereby informed that -
i. The business as set forth in the Notice of the 31st AGM dated 25th June, 2020, shall be transacted through remote e-voting and / or e-voting system at the AGM;
ii. The remote e-voting shall commence on Thursday, 13th August, 2020 (10.00 Hrs. IST);
iii. The remote e-voting shall close on Sunday, 16th August, 2020 (17:00 Hrs. IST);
iv. The cut-off-date (Record date) for determining the eligibility to vote by remote e-voting and / or e-voting system at the AGM shall be Monday, 10th August, 2020;
v. Any person, who acquires equity shares of the Company and becomes a member of the Company after dispatch of the Notice of the AGM and holding equity shares as on the cut-off-date (Record date) i.e. Monday, 10th August, 2020, may obtain the login ID and password by sending a request at helpdesk.evoting@cdslindia.com. However, if a person is already registered with CDSL for e-voting, then existing user ID and password can be used for casting vote;
vi. Members may note that :
a) The remote e-voting module shall be disabled by CDSL beyond 17:00 Hrs. IST on Sunday, 16th August, 2020 and once the vote on a resolution is cast and confirmed by the member, the member shall not be allowed to change it subsequently;
b) The facility for e-voting will also be made available during the AGM and those members present in the AGM through VC facility, who have not cast their vote on the resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through the e-voting system at the AGM;
c) The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again; and
d) A person whose name is recorded in the Register of Members or in the Register of beneficial owners maintained by the depositories as on the cut-off-date (Record date) i.e. Monday, 10th August, 2020 only shall be entitled to avail the facility of remote e-voting and / or e-voting at the AGM and for participation at the AGM.
vii. The manner of voting remotely for members holding shares in dematerialized mode / physical mode and for members who have not registered their email addresses is provided in the Notice of the AGM. The details will also be made available on the website of the Company. Members are requested to visit www.apar.com to obtain such details.
viii. Members holding shares in dematerialized mode, who have not registered / updated their email addresses with their Depository Participants, are requested to register / update the same with the Depository Participants with whom they maintain their demat accounts and Members holding shares in physical mode, who have not registered / updated their email addresses with the Company, are requested to register / update the same with the Company by sending an e-mail at investorservices@apar.com by quoting their Folio Number and attaching a self-attested copy of PAN in order to facilitate the Company to serve the documents through the electronic mode and to receive copies of the Annual Report 2019-20 along with the Notice of the 31st AGM, instructions for remote e-voting & e-voting during AGM and instructions for participation in the AGM through VC. Alternatively, Members can update their e-mail address, Mobile No., PAN and Bank Details on the link given below :
https://www.linkintime.co.in/EmailReg/Email_Register.html
ix. The Company has appointed Mr. Hemang M. Mehta, Proprietor of M/s. H. M. Mehta & Associates, Practicing Company Secretary, Vadodara, Gujarat as the Scrutinizer to scrutinize the e-voting process in a fair and transparent manner.
x. In case of any query, members may refer to the Frequently Asked Questions (FAQs) and e-voting user manual available at www.evotingindia.com, under help section and for any grievances connected with e-voting facility, may contact Mr. Nitin Kunder - Officer (022- 23058738) or Mr. Rakesh Dalvi - Manager (022-23058542) or Mr. Mehboob Lakhani - Dy. Manager (022-23058543) at CDSL, A Wing, 25th Floor, Marathon Futrex, Mafatlal Mill Compounds, N. M. Joshi Marg, Lower Parel (E), Mumbai - 400013, or send an email to helpdesk.evoting@cdslindia.com or call on 022-23058738 / 022-23058542/43. The members who require technical assistance to access and participate in the meeting through VC may contact the above help line numbers.

By Order of the Board
For Apar Industries Limited
Sanjaya Kunder
Company Secretary

Place : Mumbai
Date : July 23, 2020

